

મો.સાયકલની ચોરી કરી તેના ઉપર મોબાઇલ/બેગ સ્નેચીંગ કરતા આરોપીને ઝડપી પાડી

વાહન ચોરી તથા બેગ સ્નેચીંગના ત્રણ ગુના શોધી કાઢતી, સુરત શહેર ક્રાઇમ બ્રાંચ.

સુરત શહેર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવાય રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર તથા સુરત શહેરમાં નોંધાયેલ વાહન ચોરી, મોબાઇલ/બેગ સ્નેચીંગના વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા તથા નાસતા-ફરતા આરોપીઓ શોધી કાઢવા માટે સુરત શહેર ક્રાઇમ બ્રાંચના PSI શ્રી પી.કે.રાહોડ નાઓ તેમની ટીમના માણસો સાથે શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન તેમની ટીમના હે.કો. રોહીત યોગેશભાઈ અને હે.કો. મુકેશ પુંડલીકભાઈ નાઓને મળેલ બાતમી હકીકત આધારે આરોપી-(૧) હીતેશ ઉર્ફે કાલુ બાપુભાઈ આહેર ઉ.વ.૨૪ રહે.૫૨, ગંગાધારા એપાર્ટમેન્ટ, ઉદયનગર-૧, માધવાનંદ આશ્રમની બાજુમાં, પીપલ્સ ચાર રસ્તા, કતારગામ, સુરત. મુળગામ-ભુસની તા.કળવંદ જી.નાશીક (મહારાષ્ટ્ર) તથા (૨) મોહમંદ નુર મોહમંદ સલીમ બરફવાલા ઉ.વ.૨૦ રહે. રહે.૩૦૧, પહેલા માળે, રૂમાની મંજીલ, સોપારી ગલી, સીંધીવાડ, ચોકબજાર, સુરત. નાઓને નીચે મુજબના મુદ્દામાલ સાથે પકડી પાડીલ છે.

\*આરોપી હીતેશ ઉર્ફે કાલુ પાસેથી નીચે મુજબનો મુદ્દામાલ કબ્જે કરી ગુના ડીટેક્ટ કરવામાં આવેલ છે.

(૧) કતારગામ પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં. ૩૧૦/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ- મુદ્દામાલ:- હોન્ડા સાઇન મો.સા. નં. GJ-05-FN-6517 કિં.રૂ. ૧૨૦૦૦/- (૨) સલાબતપુરા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૩૭૬/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૭૯(એ)૩ મુજબ મુદ્દામાલ- (૧) HP કંપનીનું લેપટોપ મોડલ નં. Pavilion g series g4-1116TU જેની કિં.રૂ. ૧૫૦૦૦/- (૨) Asus કંપનીનો સિલ્વર કલરનો મોબાઇલ ફોન આશરે કિં.રૂ. ૭૫૦૦/- તથા (૩) ઉમરા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં. ૨૮૫/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૭૯(એ)(૩) મુજબ મુદ્દામાલ :-(૧) DELL કંપનીનું બ્લેક કલરનું લેપટોપ જેનો મોડલ નં. P10F નો છે. કિં.રૂ.૨૫૦૦૦/- (૨) પટેલ રીયા વિષ્ણુભાઈના ઓરીજનલ ડોક્યુમેન્ટ જેમાં ઓરીજનલ પાન કાર્ડ, માર્ચ-૨૦૧૫ નું એસ.એસ.સી. ની ઓરીજનલ માર્કશીટ, માર્ચ-૨૦૧૭ નું ઓરીજનલ માર્કશીટ, વનિતા વિશ્રામ સંચાલીય સર વી.ડી.ટી. ગર્લ્સ હાઇસ્કૂલનું સ્કૂલ લીવીંગ સર્ટીફિકેટ નં. 745, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના બેચલર ઓફ ઇન્ટીરીયર ડીઝાઇન કોર્સના (ફર્સ્ટ સેમેસ્ટર) નવેમ્બર-૨૦૧૭, ફર્સ્ટ સેમેસ્ટર એપ્રિલ-૨૦૧૮, સેકન્ડ સેમેસ્ટર એપ્રિલ-૨૦૧૮, થર્ડ સેમેસ્ટર ઓક્ટોબર-૨૦૧૮, ફોર્થ સેમેસ્ટર માર્ચ-૨૦૧૯ ના રીઝલ્ટ, તથા યુનીયન બેન્કની ચેકબુક, પાસબુક, ઝોરાસ્ટ્રીયન બેન્કનો બ્લેન્ક ચેક નં. 236968 મળી આવેલ છે.

\*આરોપી મોહમંદ નુર ઉર્ફે તન્નુ પાસેથી નીચે મુજબનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.

મુદ્દામાલ:-(૧) સેમસંગ DUAS મોડલ નં. J-5 ગોલ્ડન કલર (૨) સેમસંગ ગેલેક્સી મોડલ નં. J-2 Pro ગોલ્ડન કલર (૩) સેમસંગ મોડલ નં. J-7(2016) બ્લેક કલર (૪) સેમસંગ મોડલ નં. J-7(2016) ગોલ્ડન કલર (૫) બ્લેક બેરી કંપનીનો બ્લેક કલરનો મો.ફોન મોડલ નં. Z-30 (૬) લેનોવા કંપનીનો બ્લેક એન્ડ વ્હાઇટ મોડલ નં. K50A40 (૭) ટેકનો કંપનીનો ગોલ્ડન કલરનો મો.ફોન મોડલ નં. W4 (૮) ઓપો કંપનીનો રોઝ ગોલ્ડન કલરનો મો.ફોન મોડલ નં. F3 કુલ કિં. રૂ. ૨૨,૦૦૦/-

આરોપીઓની એમ.ઓ. :- પકડાયેલ આરોપી હિતેશ ઉર્ફે કાલુ રાત્રીના સમયે મોટર સાયકલની ચોરીઓ કરે છે અને તે મોટર સાયકલ ઉપર સવારે મોપેડ ઉપર જતી લેડીસોના બેગ/પર્સની સ્નેચીંગ કરી ઉપરોક્ત ત્રણ ગુનાઓ આચરેલ છે.

આરોપીનો ગુનાહીત ઇતિહાસ:- (૧) મહીધરપુરા પો.સ્ટે. III ગુ.ર.નં.૨૦/૨૦૧૮ પ્રોહી. એક્ટ કલમ ૧૧૬(બી), ૬૫૯,એ મુજબ.